

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન સિટિઝન્સ એવોર્ડ્સ ઉત્કૃષ્ટ નિવાસીઓનું સન્માન કરશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (12 મે 2022) – સિટી ઓફ બ્રેમ્પટન સમુદાયના એવા રમતવીરો, સ્વયંસેવકો અને સ્થાનિક નાયકોનું સન્માન કરશે અને વધાવી લેશે જેમણે 2021માં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય.

બ્રેમ્પટન સિટિઝન્સ એવોર્ડ્સ એવા નાગરિકોનું સન્માન કરે છે જેમણે 2018ના વર્ષમાં નીચે આપેલ ક્ષેત્રોમાં કોઈ અર્થસભર ફાળો આપ્યો હોય અથવા કોઈ નોંધપાત્ર ઉપલબ્ધિ હાંસલ કરી હોય:

- [સ્પોર્ટ્સ એચિવમેન્ટ એવોર્ડ્સ](#) (રમતગમતમાં ઉપલબ્ધિ પુરસ્કાર) એવા વ્યક્તિઓ કે ટીમ્સનું સન્માન કરે છે જેમની ઉપલબ્ધિઓનું સન્માન પ્રાંતીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યું હોય.
- [કેન ગાઈલ્સ \(Ken Giles\) અમેચ્યોર એથલીટ ઓફ ટ યર એવોર્ડ્સ](#) એવા ઉત્કૃષ્ટ વ્યક્તિને એનાયત કરવામાં આવે છે જેમણે પોતાની રમતમાં અમેચ્યોર સ્તરે (એટલેકે જેઓ વ્યવસાયિક સ્તરે રમતા ન હોય) નોંધપાત્ર પ્રભાવ દાખવ્યો હોય અને/અથવા અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હોય.
- [આર્ટ્સ અકલેઈમ એવોર્ડ્સ](#) (કલા પ્રશંસા પુરસ્કાર) એવા વ્યક્તિઓને સન્માનિત કરે છે જેમના કલાના ક્ષેત્રમાં કરેલ યોગદાનથી સ્થાનિક, પ્રોવિંશ્યલ, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રશંસા હાંસલ થઈ હોય.
- [લોંગ ટર્મ સર્વિસ એવોર્ડ્સ](#) (દીર્ઘકાલીન સેવા પુરસ્કાર) સમર્પિત સ્વયંસેવકોને સન્માનિત કરે છે જેમના મનોરંજનલક્ષી રમતગમત, કલા અને સમુદાયિક સમાજ સેવાના વિકાસ માટેના પ્રયાસોથી નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોય.
- [ઈન્સ્પિરેશનલ એવોર્ડ્સ](#) (પ્રેરણાલક્ષી પુરસ્કાર) બ્રામ્પટનના એવા નિવાસીઓનું સન્માન કરે છે જેઓ પરોપકારી હોય અને પરોપકારના હિમાયતી હોય અથવા જેઓએ અન્ય લોકો મટે પ્રેરણારૂપ હોય.
- [સિટિઝન્સ ઓફ ટ યર એવોર્ડ્સ](#) (વર્ષના ઉત્કૃષ્ટ નાગરિક પુરસ્કાર) તમામ વયના બ્રેમ્પટનના સ્વયંસેવકોને સન્માનિત કરશે જેમણે 2021માં આવેશપૂર્ણ અને સમર્પણના ભાવથી સમુદાયમાં પોતાનો ભાગ ભજવ્યો હોય.

તમામ નામાંકનોની સમીક્ષા સમુદાયના સભ્યોની પસંદગી સમિતિ દ્વારા થઈ હતી જેઓ જેને પુરસ્કારના વર્ગના વિષયના વિશેષજ્ઞ હોય જેમની સાથે ચુંટાયેલ અધિકારીઓ, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ, બ્રેમ્પટન સ્પોર્ટ્સ અલાયન્સ, બ્રેમ્પટન સિનિયર્સ કાઉન્સિલ અને પીલ રિજનલ પોલીસ પણ સામેલ હતાં.

2021 બ્રેમ્પટન સિટિઝન એવોર્ડ વિજેતાઓનું સન્માન મે 25ના રોજ રોજ થિએટરમાં આયોજીત સમારોહમાં કરાશે. તમામ એવોર્ડ વિજેતાઓની સૂચિ અહીં જુઓ brampton.ca/citizensawards.

સુવાક્યો

"બ્રેમ્પટન સિટિઝન એવોર્ડ્સ અમને આપણા ઉત્કૃષ્ટ નાગરિકોને અને રમતવીરો, કલાકારો, સ્વયંસેવકો અને સ્થાનિક નાયકોને તેમના યોગદાન માટે સન્માનિત કરવાનો મહામૂલો અવસર આપશે. જેમણે નામાંકનો રજૂ કર્યા તેમનો ખૂબ ખૂબ આભાર. આ પુરસ્કારો ગૌરવની લાગણી ઊભી કરે છે, સ્થાનિક નાગરિકોનો તેમના અર્થપૂર્ણ યોગદાન માટે સ્વીકાર કરે છે અને બ્રામ્પટનમાં રહેલ દરેકજણને આપણા સમુદાયમાં ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરે છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"1974થી જ આપણા સમુદાયના લોકોના યોગદાનનું સન્માન બ્રેમ્પટન સિટિઝન એવોર્ડ્સથી કરવાની જૂની પરંપરા રહેલી છે. આવા અજોડ નાગરિકોનું રોજ થિએટરમાં સન્માન કરતા અમને અતિશય આનંદ થાય છે જેમણે 2021માં નોંધપાત્ર કાર્ય કર્યું હતું નિવાસીઓ તેમના વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં મુલાકાત લે brampton.ca/citizensawards."

- માર્ટિન મેડિરોસ, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4 પ્રમુખ, સિટિઝન્સ એવોર્ડ કમિટી, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટનવાસીઓ રોજેરોજ આપણા સમુદાયમાં ઉજળું પરિવર્તન લાવતા રહ્યા છે અને સિટિઝન્સ એવોર્ડ્સ અમને એવો અવસર પ્રદાન કરે છે જેથી અમે તેમના જોશ અને યોગદાનનું સન્માન કરી શકીએ. આખા 2021માં તમારા અર્થપૂર્ણ યોગદાન માટે તમામ વિજેતાઓનો ખૂબ આભાર."

- હરકિરત સિંઘ, સીટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન આવા જોશીલા અને પ્રેરણાદાયક નિવાસીઓથી છલકાય છે જેમણે આપણા સમુદાયમાં સાચું પરિવર્તન આણ્યું. સીટી ઓફ બ્રેમ્પટન આપણા 2021 બ્રેમ્પટન સિટિઝન એવોર્ડ વિજેતાઓના જબરદસ્ત યોગદાનને સન્માનિત કરતા ગર્વની લાગણી અનુભવે છે."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca